https://archive.org/details/bk957/page/n0/mode/1up

2010-04-18 -Draft Samadhan between Satpanth and Sanatan (957)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

|| શ્રી ઉમિયાય નમઃ ||

(Trust Regd No A-828 Kutch Dt 6-4-1965)

SHRI AKHIL BHARTIYA KUTCH KADAVA PATIDAR SAMAJ
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ

Patidar Vidhyarthi Bhavan, NAKHATRANA - Kutch. PIN : 370615 Phone : (02835) 222149, 292700, Fax : 221049
પાટીદાર વિદ્યાર્થી ભવન, નખત્રાણા - કચ્છ, પીન : ૩૭૦૬૧૫. ફોન : (૦૨૮૩૫) ૨૨૨૧૪૯, ૨૯૨૭૦૦, ફેક્સ : ૨૨૧૦૪૯
Web. : www.kkpsamaj.org * E-mail : kkpsamaj@in.com

પત્ર ક્રમાંક :

તારીખ : 17/4/10

પ્રતિશ્રી,

.........કરશનભાઈ વાલજી વેલાણી..........................
....

સવિનય જણાવવાનું કે આજ રોજ તા.૧૭/૪/૨૦૧૦ના સમાજના માનનીય પ્રમુખશ્રી રામજીભાઈ કરમશીભાઈ નાકરાણીના અધ્યક્ષ સ્થાને મળેલ સભામાં સાંપ્રદાયિક મતભેદને દુર કરવા અને સમાજનો સુવર્ણ જયંતી મહોત્સવ સંપ, સંઘઠન અને સહકારથી ઉજવાય તે માટે સનાતન અને સતપંથના ચાલતા વિવાદોનું સુખદ સમાધાન કરાવવા માટે આપશ્રીને સતા આપવામાં આવે છે.

૧) ધનજીભાઈ ગોવિંદ સેંઘાણી–રાજપર
૨) મનસુખભાઈ વિશ્રામ રૂડાણી–અમદાવાદ
૩) ગંગામભાઈ શીવદાસ રામાણી–ભુજ
૪) દેવજીભાઈ માવજી લીબાણી–ભુજ
૫) શામજીભાઈ નારણ નાકરાણી–મુંબઈ
૬) કરસનભાઈ વાલજી વેલાણી–ભુજ
૭) કૌશલભાઈ ગંગારામ લીબાણી–અમદાવાદ
૮) વાલજીભાઈ નાકરાણી - ગોરજી

આપનો વિશ્વાસુ

રામજીભાઈ કરમશીભાઈ નાકરાણી
પ્રમુખશ્રી
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ

realpatidar.com

https://archive.org/details/bk957/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v6.py

https://archive.org/details/bk957/page/n2/mode/1up

Real Patidar
Unravel Truth

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.20 13:09:32 +05'30'

॥ શ્રી ઉમિયાયે નમઃ ॥

(Trust Regd No A-828 Kutch Dt 6-4-1965)

SHRI AKHIL BHARTIYA KUTCH KADAVA PATIDAR SAMAJ
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ

Patidar Vidhyarthi Bhavan, NAKHATRANA - Kutch. PIN : 370615 Phone : (02835) 222149, 292700, Fax : 221049
પાટીદાર વિદ્યાર્થી ભવન, નખત્રાણા - કચ્છ, પીન : ૩૭૦૬૧૫. ફોન : (૦૨૮૩૫) ૨૨૨૧૪૯, ૨૯૨૭૦૦, ફેક્સ : ૨૨૧૦૪૯
Web. : www.kkpsamaj.org * E-mail : kkpsamaj@in.com

realpatidar.com

પત્ર ક્રમાંક :

તારીખ : 17/4/10

પ્રતિશ્રી,

~~.........કરશનભાઈ વાલજી વેલાણી..........................~~

....

સવિનય જણાવવાનું કે આજ રોજ તા. ૧૭/૪/૨૦૧૦ ના સમાજના માનનીય પ્રમુખશ્રી રામજીભાઈ કરમશીભાઈ નાકરાણીના અધ્યક્ષ સ્થાને મળેલ સભામાં સાંપ્રદાયિક મતભેદને દુર કરવા અને સમાજનો સુવર્ણ જયંતી મહોત્સવ સંપ, સંઘઠન અને સહકારથી ઉજવાય તે માટે સનાતન અને સતપંથના ચાલતા વિવાદોનું સુખદ સમાધાન કરાવવા માટે આપશ્રીને સતા આપવામાં આવે છે.

૧) ધનજીભાઈ ગોવિંદ સેંઘાણી–રાજપર
૨) મનસુખભાઈ વિશ્રામ રૂડાણી–અમદાવાદ
૩) ગંગામભાઈ શીવદાસ રામાણી–ભુજ
૪) દેવજીભાઈ માવજી લીબાણી–ભુજ
૫) શામજીભાઈ નારણ નાકરાણી–મુંબઈ
૬) કરસનભાઈ વાલજી વેલાણી–ભુજ
૭) કૌશલભાઈ ગંગારામ લીબાણી–અમદાવાદ
૮) વાલજીભાઈ નાકરાણી - ગોરજી

આપનો વિશ્વાસુ

રામજીભાઈ કરમશીભાઈ નાકરાણી
પ્રમુખશ્રી
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ

Background:

During the process find resolution of Satpanth issue in KKP community, in which Satpanth side and Sanatan sides had appointed Umiya Mataji Unjha as arbitrators (see Unjha judgement dated 08-Oct-2017 for more details), Prof Vishram Rudani (who was not from any side), though being a Sanatani Hindu, in a act of betraying Sanatan Samaj, was openly supporting Satpanth side, with the aim of confusing Unjha people. He gave a copy of this letter and told them that a solution between Satpanth and Sanatan sides was agreed, but ABKKP Samaj (Sanatan side) backtracked.

This is completely false story, as the solution mentioned in this letter is a proposed solution, subject to approval of ABKKP Samaj (Sanatan Side),as mentioned in the letter itself. The solution when put to scrutiny of Sanatan side, failed the test of mandate/authority clause. The people negotiating from Sanatan Side, at the time of appointing were not given any authroity find a solution on Satpanth issue. They were only told to convince Satpanthis to withdraw all false cases in court and police, against Sanatani members. For these reasons, this proposed solution was unanimously rejected by all members of Sanatani Side.

---

https://archive.org/details/bk957/page/n3/mode/1up

realpatidar.com

[illegible]

સમાજીક એક્તા અભિયાન હેઠળ થયેલ સમાધાન અને વાસ્તવિક્તા

તારીખ 18/04/2010

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર કેન્દ્રીય સમાજના પ્રમુખ દ્વારા તારીખ 25/03/2010ના રોજ કેદ્રીય સમાજના બંધારણનું વિકૃત અર્થ ઘટન કરતું દુરભાગ્ય પુર્ણ શ્વેતપત્ર બહાર પાડેલ છે.જેથી સમાજમાં બહોળા પ્રમાણમાં ખોટા પ્રત્યાઘાત પડેલા જેથી વ્યથીત કેન્દ્રીય સમાજની કારોબારીએ સમાજમાં વરસોથી ચાલતા આવતા વિવાદોનું સુખદ કાયમી નિવારણ આવે તે માટે માનનિય ધારાસભ્યશ્રી ધનજીભાઇ ગોવિંદભાઇ સેંધાણી (મંગળદાદા)ના અધ્યક્ષ સ્થાને / કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખશ્રી સામજીભાઇ નાકરાણી, તથા મનસુખભાઇ રૂડાણી/ કેન્દ્રીય સમાજના ટ્રસ્ટીશ્રી દેવજીભાઇ માવજીભાઇ લીંબાણી/માજી મહામંત્રીશ્રી વાલજીભાઇ નાકરાણી /ભુજ ઝોનના કરશનભાઇ વેલાણી /મહામંત્રીશ્રી સુરેશભાઇ ચૌહાણ /ભુજ સમાજના પ્રમુખ શ્રી ગંગારામભાઇ શીવદાસભાઇ તેમજ અમદાવાદના કૌશલભાઇ સહિતની સમાધાન માટે સતા આપી સમીતીની નિમણુક કરેલ. જેમણે સામાજક એક્તા અભિયાન હેઠળ તારીખ 18/04/2010ના રોજ અમદાવાદ ખાતે સતપંથ સંપ્રદાય સમાજના આગેવાનો સાથે સમાજની કાયમી એક્તા માટે તથા સુવર્ણ જયંતીની ઉજવણી માટે ગહન ચર્ચા વિચારણાને અંતે સર્વ સમંતિથી અગીયાર મુદાની સમાધાનની ફેરમ્યુલા તૈયાર કરેલ જે આ સાથેના પત્રમાં દર્શાવેલ છે.

ઉપરોક્ત મુદાઓ સાથેની સર્વ સમંત સમાધાન ફોરમ્યુલા કેન્દ્રીય સમાજના ઉપરોક્ત પ્રતિનીધીઓ દ્વારા તારીખ 19/04/2010 ના રોજ કેન્દ્રીય સમાજના હોદેદારો સમક્ષ રજુ કરવામાં આવેલ અને સૌ સભ્યોને સમાધાન ફોરમ્યુલા બાબત ચર્ચા વિચારણા ચાલતી હતી તે દરમ્યાન સમાજની એક્તાના હીત શત્રુઓના નેત્રુત્વ હેઠળ સમાજના બસો ઉપરાંત ભાઇઓએ જબર જસ્તી કરી સામાજીક એક્તા અભિયાન સમિતીના સભ્યોની બે ઇજતી તથા કાયદા વિરોધ કરતાં મીટીંગ કોઇ પણ નિર્ણય કર્યા વગર મુલત્વી રાખવી પડી હતી અને સમાધાન સમિતીના કેન્દ્રીય સમાજના ઉપરોક્ત હોદેદારોએ આ ઘટનાથી નારાજ થઇ પોતાના હોદા ઉપરથી રાજીનામાં ધરી દીધા હતાં. આવા સમાજની એક્તા વિરોધી તત્વો બહુમતીના જોરે કેન્દ્રીય સમાજ ઉપર દબાણ લાવી શ્વેતપત્ર જેવા અનેક કાર્યો બળ જબરીથી કરાવવામાં આવે છે. તેમની સામે સમાજે એક થઇ સમાજની એક્તા માટે સજાગ બનવું પડશે અને આવા સમાજ વિરોધી તત્વોને રોકવા પડશે. [illegible]

realpatidar.com

realpatidar.com

શ્રી જય ઉમીયા માતાય નમ:

આજ તા.૧૮/૪/૨૦૧૦ નારોજ અમદાવાદ મુકામે સાપ્રદાયીક મત ભેદોને દુર કરવા અને સમાજ માં સંપ.સગઠન અને એકતા જળવાઇ રહે તે માટે સનાતન અને સતપંથ ના ચાલતા વિવાદો નું સુખદ સમાધાન માટે કેન્દ્રીય સમાજ ના નિયુકત કરેલ પ્રતિનીધીઓ તેમજ સતપંથ સંપદાય ના પ્રતિનીધી વચ્ચે થયેલ સમાધાન બેઠકમા બંને પક્ષના મોવડીઓ તરફ થી મંજુરી ની **અપેક્ષાએ** નીચે મુજબ ના સમાધાન ના મુદાઓ નક્કી કરેલ છે.

(૧)અખિલ ભારતીય ક.ક.પા. સમાજ ના દરેક **સભ્ય એ મુળ હિન્દુ સનાતની** છે. જે કોઇ પણ સંપ્રદાય પાળતા હોય જેમ કે લક્ષ્મીનારાયણ. સ્વામિનારાયણ. સતપંથ.ગાયત્રી પરિવાર તેમજ આર્યસમાજ અને અન્ય કોઇ પણ હિન્દુ ધર્મ માં માનતા હોય તેવા તમામ સમાજ ના સભ્યએ સમાજ ના તમામ કાર્યક્રમો તેમજ મહોત્સવો સાથે રહી ઉજવવાના છે.

(૨) તા.૨૫/૩/૨૦૧૦ નારોજ બહાર પાડવામાં આવેલ સમાજ ના સ્વેતપત્ર સતપંથ કે કોઇ પણ સંપ્રદાય વિરૂધ્ધ બહાર પાડવામાં આવેલ નથી.

(૩) શ્રી અ.ક.ક.પા. સમાજ ના ૧૮ વર્ષ થી ઉપર ની ઉંમર ની કોઇ પણ વ્યકિત ગમે ત્યાં રહેતી હોય તે સમાજ ના બંધારણ ના નિયમો મુજબ સમાજ નો સભ્ય થઇ શકે છે.

(૪) સમાજ ના રીતરિવાજ ના નિયમ ૧ થી ૧૯ નુ પાલન કરવુ તે સમાજ ના દરેક વ્યકિત ની ફરજ છે.

(૫) અ.ક.ક.પા. સમાજ ના દરેક ભાઇ બહેનો માં ઉમીયા ના સંતાનો છે. અને ગમેતે સંપ્રદાયમાં માનતા હોય તે સાથે મળી ને સમાજ નો સુવર્ણ જયંતી મહોત્સવતેમજ ભવિષ્ય માં સમાજ ના દરેક પ્રસંગો સોએ સાથે મળી ને ઉજવવાના રહે છે. જે માટે દરેક સમાજ ના ભાઇઓ દરેક કાર્ય માં વોલીન્ટર તરીકે જોડાઇ તમામ કાર્ય પાર પાડવામાં રહેછે.તેમજ પ્રચાર પ્રસાર માં પણ દરેક ભાઇઓ સાથે રહેવાનુ છે.

(૬) સમાજ તરફ થી બહાર પાડવામાં આવેલા સ્વેત પત્ર પહેલા કે પછી થી સમાજ/ઝોન ની કારોબારી માંથી દુર કરવામાં આવેલ સતપંથી ભાઇઓ ને તેમના સ્થાને તાત્કાલીક પુન: સ્થાપિત કરવા તેમજ સભ્યને દુર કરતા ઠરાવ રદ કરવા.

(૭) સમાજ ની એકતા ના વાતાવરણ ને દુષિત કરનાર કોઇ પણ સભ્ય સામે જે વ્યકિત ની લાગણી દુભાઇ હોય તે વ્યકિત વ્યકિતગત રીતે જવાબ દાર સામે પગલા ભરી સકશે.

(૮) સુવર્ણ જયંતી પ્રસંગે બહાર પડાનાર ઇતિહાસ વિદ ગ્રંથ માં કોઇ પણ સંપ્રદાય ની લાગણી દુભાય તેવુ કોઇ લખાણ કે સાહિત્ય પ્રકાશીત કરવુ નહી.

realpatidar.com

realpatidar.com

(૯) કોઇપણ ઉજવતા પ્રસંગ સ્ટેજ પરથી કે અન્ય સ્થળે કોઇ પણ સંપ્રદાય ના લાગણી દુભાય તેવુ ભાષણ કે વર્તન કરવુ નહી.

(૧૦) કોઇ પણ મુખપત્રો કે છાપાઓ માં કોઇ પણ સંપ્રદાયની લાગણી દુભાય તેવા લેખો કે માહીતી છાપવી નહી.

(૧૧) આ સમાધાન આખરી મંજુર થયે થી તેની યોગ્ય પ્રસિધ્ધી કરવી જેથી આ સમાધાનની જાણકારી સમાજ ના દરેક સભ્ય ને થાય જેથી કોઇ પણ પ્રકાર ની ગેર સમજ રહે નહી તેમજ આ સમાધાન ની લેખીત જાણકારી સમાજ ના દરેક ઝોન ને તાત્કાલીક કરવી

ઉપરોક્ત નિર્ણય શ્રી [illegible]ભાઇ [illegible] ની અધ્યક્ષતા મા કરેલ છે.

૧. ડી. જી. પટેલ

૨. [illegible] ધનજી [illegible]

૩. [illegible] ઉકેડા [illegible]

૪. [illegible] [illegible]

૫. [illegible] [illegible] પટેલ

૬. [illegible]

૭. અનિલકુમાર ગંગારામભાઇ પટેલ

૮. શાંતિભાઇ [illegible] [illegible]

૯. [illegible] બાબુભાઇ

૧૦ ગંગારામ સોમજી [illegible]

૧૧ કરસનભાઇ વાલજી [illegible] ભુજ

૧૨ સુરેશભાઇ [illegible] [illegible] ભુજ

૧૩ [illegible] સુરેશભાઇ કે. [illegible]

૧૪. [illegible] [illegible]

૧૫. [illegible] કરસન [illegible]

૧૬. [illegible] [illegible] પટેલ [illegible]

૧૮ જયંતિભાઇ [illegible] ચોપડા J.M. [illegible]

૧૯. [illegible] [illegible] પટેલ

૨૦ [illegible] કરસનભાઇ [illegible]

૨૨ [illegible]ભાઇ [illegible]ભાઇ પટેલ [illegible]

realpatidar.com